



THE FREE INDOLOGICAL COLLECTION

WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC

FAIR USE DECLARATION

This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.

Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.

If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.

-The TFIC Team.

सामायक वृत्.

विधिसाहित, छक्कमिना ऐस, अने हेव, शुरू,
धर्म ए नाणु तत्वनी श्रीणाथाणु विष्णु उचिता
महा पंडित गोल्य पुज्य थो देवल रवागीना
शिव लाधाणु रवामि आसे शुरु इरावी
छपाची प्रसिद्ध करनार

आवक. पुरुषोत्तम काहानजी गांधी.
लीभडी,

अमहावाहमां

गाडीयामां सारं गपूर ज्ञाना रक्तापूर
गलेताळ पीतांगरदास विशुवनदासना
मकानगां हितेरुषु प्रेसमां नशंग
मुण्डुम्बे छापुं.

राखत १६३८ सने १८८८

मूल्य. ए आना.

अथ श्री सामायक लख्युं छै.

उघाडे मुखे तथा दीवाने अजवाळे वांचवुं नहीं.



नवकार मंत्र. पाठ ॥१॥

नमो अरिहंताखुं ॥ नमो सिद्धाखुं ॥ नमो
आयरियाखुं ॥ नमो उवङ्गायाखुं ॥ नमो लोभे
संवसाखुं ॥ १ ॥



तिखखुत्तो अथवा वंदना. पाठ ॥२॥

तिखुतो ॥ आयाहिखुं ॥ पयाहिखुं ॥ वंदाभि ॥
नभंस्साभि ॥ सकारेभि ॥ सभाषेभि ॥ कलाखुं ॥
भंगण ॥ देवयं ॥ चेष्यं ॥ पञ्जलुवा साभि ॥ २॥



इरियावहि. पाठ ॥३॥

इरियाभि पठिक्भित्ति ॥ इरिया वहियाए॥विराहुश्चाए
॥ गमेषु। गमेषु ॥ पाखु झगेषु ॥ खीय झगेषु॥

(२)

હરિય ઝુંખે॥ ઉસા ઉત્તિંગ॥ પણુગ દગ્ગા॥ ભદ્ર ભ-
કુડા॥ સંતાણા સંઝુંખે॥ જેમે જીવા॥ વિરાહિયા॥
અગિંદિયા॥ યેદીદિયા॥ તેદીદિયા॥ અજરિંદિયા॥ પાચિં
દિયા॥ અલિહિયા॥ વત્તિયા॥ લેસીયા॥ સંધાઈયા॥
સંધાઈયા॥ પરીયાવિયા॥ કીલામિયા॥ ઉદ્વિયા॥
ઢાણુંએઠાણું॥ સંકામિયા॥ જીવિયાએ॥ વવરોવિયા॥
તસ્સમિચ્છામિ દુઝુડં॥ ૩ ॥ .

—૦૫૦—

તસ્સઊત્તરી, પાઠ ॥૪॥

તસ્સ ઉતરી કરણેણું॥ પાયચિત કરણેણું॥ વિસો-
હિ કરણેણું॥ વિસસદ્દી કરણેણું॥ પાવાણું કરું-
ણું॥ નિધાયણું ઠાએ॥ ઠામિ કાઉસગં॥

અનથથઉસસિએણું॥ નિસસીએણું॥ ખાસિએણું॥ છી
એણું॥ જાલાદુએણું॥ ઉડુએણું॥ વાયનિસગેણું॥ ભમ
લિએ॥ પિતમુછએ॥ સુહુમેહિઅંગસંએલેહિ॥ સુહુમેહિ
એલસંચાલેહિ॥ સુહુમેહિદિસંચાલેહિ॥ અવમાદએહિ॥
એગારેહિઅભગે॥ અવિરાહિએ॥ હુજનમેકાઉસગે॥

(४)

નવઅરિહુંતાણું ॥ ભગવંતાણું ॥ નમોકારેણું ॥ ૧-
પારેમિ ॥ તાવકાયં ॥ ઠાણેણું ॥ મોણેણું ॥ ઝ્રાણેણું ॥
અપાણું ॥ વોસિરામિ ॥ ૪ ॥

આંહીએં દરિએ વહિએનો, એને નવકાર એકનો
કાઉસગ કરવો, એને નમો અરિહુંતાણું કહી તે
કાઉસગ પાળવો. ॥

— ૦ —

લોગસ્સ.

પાઠ ॥ ૩ ॥

લોગસ્સ ઉજ્જેયગરે ॥ ધર્મમતિથયરેણું ॥ અરિ-
હુંતે કિતાસ્સં ॥ ચડવી સાંપિ ડેવલી ॥ ૧ ॥ ઊસશ
મનિયંચવંદે ॥ સંભવ મલિ નંદણું ॥ ચસુમઈચ ॥
પદ્મપદ્મહું સુપારાં ॥ જિણુંચ ચંદ્રપહુંદે ॥ ૨ ॥
સુવિહિંચ પુરુંદંતં ॥ રિચ્યાસિજજંસ વાસુપુજજંચા ॥
વિમલ મણુંતંચનિણું ॥ ધર્મસાતિચવંદામિ ॥ ૩ ॥
કુંથું અરંચમલિં ॥ વંદે મુખિસુવયં નમિનિણુંચ ॥
વંદામિ રિફનેમિ ॥ પાસંતડ વદ્રમાણુંચ ॥ ૪ ॥ એ-
વંભય અલિથુયા ॥ વિહૃયરયમલી પહીણું જરમરણું ॥

(४)

अउवीसंपी निषुवरा ॥ तिथ्यरामे पक्षीयंतु ॥ ५ ॥
 क्रित्यवंदिय महियाजे ए लोगस उतमा सिद्ध ॥
 आङ्गं जोहिलालं ॥ सभाहिवर मुतमंदितु ॥ ६ ॥
 अंद्वनिभ्मलयरा ॥ आधर्ये सुअहियं पयासयरा ॥
 सागर वर गंलीरा ॥ सिद्धा सिद्धिभ मंदिसंतु ॥ ७ ॥
 हुवे सभायकनी आज्ञा भागीने—

—०—

सामायक आदरवानी रीत.

पाठ ॥ ६ ॥

द्र०४ थकी सावज्जेग सेववाना पच्याणु ॥ १ ॥
 लेन थकी आभा लोक प्रभागे ॥ काण थकी ऐ धडी
 सुधी ॥ ते उपरांत नणु नवकार गणी न पाणु ति-
 वार सुधी ॥ ३ ॥ भावयकी छ कोटीम्ब पच्याणु ॥ ४ ॥
 कुरेमि भंते सामाधयं ॥ सावज्जं ज्जेगं पच्याभा-
 मि ॥ ज्व नियम पज्जुवा साभि ॥ हुविहं ति-
 विहेणु ॥ न कुरेमि ॥ न कारवेमि ॥ भणुसा वय
 सा कायसा ॥ तस्सभंते पंडिक्माभि ॥ निदाभि ॥
 गिरीहाभि ॥ अप्याणु वेसिराभि ॥ ६ ॥

—०—

(૫)

નમોધ્યુણ.

પાઠ ॥ ૭ ॥

શ્રી નમોધ્યુણ ॥ ૧ ॥ અરિહંતાણું ॥ ૨ ॥ લગ-
વંતાણું ॥ ૩ ॥ આઇગરાણું ॥ ૪ ॥ તિથથયરાણું ॥ ૫ ॥
સયંસંયુક્તાણું ॥ ૬ ॥ પુરિસોત્તમાણું ॥ ૭ ॥ પુરીસસી
હાણું ॥ ૮ ॥ પુરીસવર પુંડરીયાણું ॥ ૯ ॥ પુરીસવર
ગંધહૃથીણું ॥ ૧૦ ॥ લોગુતમાણું ॥ ૧૧ ॥ લોગના-
હાણું ॥ ૧૨ ॥ લોગહિયાણું ॥ ૧૩ ॥ લોગપદવાણું ॥ ૧૪ ॥
લોગ પજને યગરાણું ॥ ૧૫ ॥ અભયદ્યાણું ॥ ૧૬ ॥
અખૂદ્યાણું ॥ ૧૭ ॥ મગદ્યાણું ॥ ૧૮ ॥ સરણુદ્યા-
ણું ॥ ૧૯ ॥ જવદ્યાણું ॥ ૨૦ ॥ બોહિદ્યાણું ॥ ૨૧ ॥
ધર્મદ્યાણું ॥ ૨૨ ॥ ધર્મમહેસિયાણું ॥ ૨૩ ॥ ધર્મના-
યગાણું ॥ ૨૪ ॥ ધર્મમસારહિણું ॥ ૨૫ ॥ ધર્મવર ચાઉ
રંત ચક્ક વઢીણું ॥ ૨૬ ॥ દીવો ॥ ૨૭ ॥ તાણું ॥ ૨૮ ॥
સરણ ॥ ૨૯ ॥ ગઈ ॥ ૩૦ ॥ પદ્ધા ॥ ૩૧ ॥ અપર્દિહૃપ
વરનાણું દંસણું ધરાણું ॥ ૩૨ ॥ વિયટછઉમાણું ॥ ૩૩ ॥
ળણુાણું ॥ ૩૪ ॥ જવયાણું ॥ ૩૫ ॥ તિનાણું ॥ ૩૬ ॥
તારયાણું ॥ ૩૭ ॥ બુદ્ધાણું ॥ ૩૮ ॥ બોહિયાણું ॥ ૩૯ ॥

(६)

मुत्ताणुं ॥४०॥ भोयगाणुं ॥४१॥ सै०वनुणुं ॥४२॥
 स०व०दरिसिणुं ॥४३॥ सिव ॥४४॥ भयल ॥ ४५ ॥
 भ०४ ॥४६॥ भणुंत ॥४७॥ भ०व्य ॥४८॥ भ०वा०भा०ह ॥४९॥
 भ०पुणुं रा०वति ॥५०॥ सिद्धिग०४ ना०भ०धे०य ॥५१॥
 ढा०णुं स०प०ता०णुं ॥५२॥ नभो० जिणु०णुं ॥५३॥ जिय
 भया०णुं ॥५४॥

—०—

हवे सामायक पाळवानो विधि लख्यो हे.
 पाठ ॥ ८ ॥

अहुवा नवभा सामायक वृतना ॥ पंचाय०यारा ॥
 जणुीयना ॥ नसभायरिवा ॥ तंजहा ॥ ते आलोडि ॥
 भणु हु०प०हीहाणु ॥१॥ वयहु०प०हीहाणु ॥२॥ काय-
 हु०प०हिहाणु ॥३॥ सामायिस्स स॒धि॒यक॒रणु॒या॒ये ॥४॥
 सामायिस्स आ॒णु॒वडि॒य स्सक॒रणु॒या॒ये ॥५॥ तस्स-
 मिष्ठामिदु॒क्त ॥१॥ सामायक समका॒म्भेणुं ॥ नहा-
 स्त्रीय ॥ नपाकीय ॥ नतिरिय ॥ नकिडिय ॥ न-
 सोङ्गिय ॥ न आसहिय ॥ आण्टाय ॥ आण्टुपा-
 लिता ॥ नलवध ॥ तस्समिष्ठामि॒हु॒क्त ॥२॥

(७)

सामायकमां हृषा मनना ॥ हृषा वचनना ॥ खार
कायाना ॥ खनीरा होय भाँहेलो ए क्षेत्र होय लाँयो
होय तो तस्स मिथामि हुङ्कडं ॥३॥

सामायकमां स्त्रि कथा ॥ भत्त कथा ॥ हेरा कथा ॥
राज कथा ॥ ए चार कथा भाँहेली क्षेत्रकथा करी
होय तो तस्स मिथामि हुङ्कडं ॥४॥

सामायक विधिए लीधुं ॥ विधिए पाल्युं ॥ वि
धिए करतां अविधिए थयुं होयतो ॥ तस्समिथा-
मि हुङ्कडं ॥५॥

सामायकमां अतिकरम व्यतिकरम ॥ अतिचार ॥
अगुच्छार ॥ जाणुतां ॥ अजाणुतां ॥ भने ॥ वचने ॥
कायाए ॥ करी क्षेत्र होय लाँयो होय तो तस्स
मिथामि हुङ्कडं ॥६॥ सामायकमां कानो भावा
भाँडी ॥ ५६ अक्षर ॥ ओछो अधिक विपरित ल-
ण्णयो होय तो अनंत सिद्ध केवणीनी साखे भाहरे
तस्स मिथामि हुङ्कडं ॥७॥

हुवे सामायक करवानो विधि लज्यो छे.

प्रथम भोङ्गती ५३ लेहणु • करी खांधवी. ॥१॥

(८)

પાથરાણું જોઈ ને પાથરલું ॥ ૨ ॥ જોણો તથા રજો
હરણો પડીલેહણુ કરી રાખવો ॥ ૩ ॥ લધુ નીતનું
ભાજન જોઈ રાખલું ॥ ૪ ॥ પેહેરવાનો કૃપડો હાથ
પાંચનો પેહેરવો ॥ ૫ ॥ ઓઠવાનો કૃપડો હાથ સાડા
પાંચનો ઓઠવો ॥ ૬ ॥ હવે સામાયકના સાત
પાઠની વિગત ॥ નવકાર ॥ ૧ ॥ તિષ્ણુત્તો ॥ ૨ ॥ ઈરણા
મિ પડીકમીળા ॥ ૩ ॥ તસ્સઉત્તરી ॥ ૪ ॥ લોગસ્સ ॥ ૫ ॥
દ્રોય થકીનો પાઠ ॥ ૬ ॥ નમો ચંદ્યણું ॥ ૭ ॥ એ સાત
પાઠ ભાળીને સામાયક કરલું ॥ ઈતી શ્રી સામાયકનો
વિધિ સંમૂહીં ॥

હવે સામાયક પાળવાના વિધિને વિષે પાઠ સાત
કહેવા ॥ તેમાં દ્રોય થકીનો પાઠ ન કહેવો ॥ ને
તેને ખદ્દલે એહેવા નવમાં સામાયક વૃતતા પંચ-
અદ્ધારાદિક કહેવા ॥

ઇતિ સામાયક પાળવાનો વિધિ સમૂહીં ॥

(८)

बन्त्रिशदौष टाळी सामायककरवुं.

ते दोष नचे मुजब.

—०—

मनना दोष ॥१०॥

निरविवेकी भने करे ॥ १ ॥ यश कीर्तनी वांच्छनाए
 करे ॥ २ ॥ धननोलाल वांच्छे ॥ ३ ॥ गर्व करे ॥ ४ ॥
 भयथी करे ॥ ५ ॥ पुत्र तथा धनादिक्षुं नियाशुं
 करेते ॥ ६ ॥ सामायकना इणनो संदेह करे ॥ ७ ॥
 अविनय करे ॥ ८ ॥ परभवे भने आ रीढ़ि हे-
 वतानी पदवी भणे अवी वांच्छना करे ॥ ९ ॥ सा-
 भायक भांडी रोष करे ॥ १० ॥ अ दोषो भनथी
 नीपने ॥

—०—

वचनना दोष ॥१०॥

कुपथन घोले ॥ १ ॥ डोर्जने धास्तो पुठे अवी भाषा
 घोले ॥ २ ॥ सामायकमां स्वर आकापे ॥ ३ ॥

(१०)

આપણે છાંદે બોલે ॥ ४ ॥ સુતા સર્કીપે બોલે ॥ ૫ ॥
 કલેરા કરે ॥ ૬ ॥ રાજ કૃથાદિક વિકૃથા કરે ॥ ૭ ॥
 હુંસી મરકરી કરે ॥ ૮ ॥ સંપદાવિના ઉતાવળો
 બોલે ॥ ૯ ॥ મોકળાને (વૃત્તવિનાનાને) જવા આ-
 વવાના આદેશ આપે ॥ ૧૦ ॥

—૦૩૦—

કાયાના દોષ ॥૧૨॥

વખ તથા જીજાએ કરી પલાંઠી ખાંધે ॥ ૧ ॥ આ-
 સન આધું પાછું ફેરવે ॥ ૨ ॥ અપળપણે સર્વ દિ-
 શાએ જૂએ ॥ ૩ ॥ અહસંખંધી સાવધય (સાવધય
 એટલે પાપકારી) ધર્મ કરે ॥ ૪ ॥ ભીતસ્થંભાદિકે
 એઠાંગી બેસે ॥ ૫ ॥ અંગઉપાંગ અતિ સં-
 હોચે ॥ ૬ ॥ આળસ મરડે તથા ધર્મ કાર્ય આળસ
 કરે ॥ ૭ ॥ ટાચકા વગાડે ॥ ૮ ॥ પુંજ્યાવિના
 શરીરનો મેલ ઉખાડે ॥ ૯ ॥ પુંજ્યાવિના શરીરે
 ખંલેણે ॥ ૧૦ ॥ વિસામજુ કરાવે (અંગ અંપાવે) ॥ ૧૧ ॥
 નિદ્રા કરે ॥ ૧૨ ॥

(૧૧)

એ ખાર દોષ કાયા થકી નીપજે. મન. વચન અને
કાયાના થઇ કુલ ખત્રિય દોષ.

—૦૪૦—

અથ શ્રી છકાયના બોલ.

હવે છકાયના નામ કહેછે ॥ પેહેલે બોલે ઈઠીયાવર
કાય ॥ ૨ ॥ ખંખીયાવર કાય ॥ ૩ ॥ સપિ થાવર
કાય ॥ ૪ ॥ સુમતિ થાવરકાય ॥ ૫ ॥ પ્રયાવચથા-
વરકાય ॥ ૬ ॥ જંગમકાય ॥ હવે ગોત્ર કહેછે ॥
પૃથ્વીકાય ॥ ૭ ॥ અપકાય ॥ ૮ ॥ તેઉકાય ॥ ૯ ॥
વાઉકાય ॥ ૧૦ ॥ વનસ્પતિકાય ॥ ૧૧ ॥ ત્રસકાય ॥ ૧૨ ॥
હવે પૃથ્વી કાયના એ લેટ ॥ સુક્ષમ અને ખાદર ॥
સુક્ષમતે આખા લોકમાં રહ્યાછે ॥ તે આપણી નજરે
ન આવે ॥ જ્ઞાની જણે દેખે ॥ હવે ખાદર પૃથ્વી કા-
યાના નામ કહેછે ॥ પેહેલે બોલે માટીને મીઠાની
જાત ॥ ૧ ॥ ખડીખારાનીજત ॥ ૨ ॥ કાળમિંઠ મર-
ડીચા પાહાણાને સિદ્ધાની જત ॥ ૩ ॥ હિંગળો હ-
ડતાળની જત ॥ ૪ ॥ જેર જોપીઅંદનની જત ॥ ૫ ॥

રતન પરવાળાની જત ॥૭॥ સોળ જતનાં રતન॥
 આદિ લેછને તેંતાળીશ જતની પૃથ્વી કાય॥ તેમાં
 એક કુડામાં અસંખ્યાતા લ્લવ શ્રી ભગવંતે કહ્યાછે॥
 તે જીવાર તથા પીલુ જેટલી પૃથ્વી કાય લઈએ॥ તે-
 માંથી એકેકો લ્લવ નીકળી પારેવા જેવહી કાયા
 કરેતો॥ એક લાખ જોજનનો જંઘુદ્વિપણે॥ તેમાં
 સમાય નહીં॥ તેનાં કુળ ખાર લાખ કરોડ છે॥ તેનું
 આઉઝું જધન્ય અંતર મુહૂરતનું॥ ઉત્કૃષ્ટ ૨૨ હજર
 વર્ષનું॥ તેની દ્વારા પાળીએતો મોકના સુખ પામીએ॥
 હવે અપકાયતે પાણું॥ તેના બે બેદ્દા સુદ્ધમ અને
 ખાદર॥ સુદ્ધમતે આખા લોકમાં ભર્યાછે॥ તે આ-
 પણી નજરે નચાવે॥ ખાદર પાણુના નામ કહેછે॥
 પેહુલે બોલે વરસાદને કરાના પાણી ॥૨॥ આકળને
 ધુમરનાં પાણી ॥૩॥ કુવા નદી તળાવનાં પાણી ॥૪॥
 દરિઓને ઝરણનાં પાણી ॥૫॥ ખારાં ખાટાં પાણી ॥૬॥
 મીઠાં મોળાં પાણી ॥૭॥ એ આદિ લેછને ધણી જ-
 તનાં પાણીછે॥ તેના એક બિંદુમાં અસંખ્યાતા લ્લવ
 કહ્યાછે॥ તેમાંથી એકેકો લ્લવ નીકળીને સરસવના દાઢા

જેવડી કાયા કરેતો લાખ જેજનના જંયુદ્વિપમાં
માય નહીં॥ તેનાં કુળ સાત લાખ કોડછો તેનું
આઉઝું જધન્ય અંતર મુહુરતનું॥ ઉઠૃકૃદું સાત હ-
ભર વર્ષનું॥ તેની દ્યા પાળીમેતો અનંતા મોકના
સુખ પામીએ॥

હુવે તેઉકાય તે અગની॥ તેની બે જતા॥ સુદ્ધમ
ને બાદર॥ સુદ્ધમ તે આખા લોકમાં ભર્યાછો॥ તે આ-
પણી નજરે નચાવે॥ હુવે બાદર અગિનનાં નામ
કહેછો॥ પેહેલે બોલે શૂલા ને ભહોની અગિન ॥૨॥
ધુમાડા તાપણીની અગિન ॥૩॥ ઘકમકને વિજળીની
અગિન ॥૪॥ દીવાને ઉમાડાની અગિન ॥૫॥ લોઢા
ધગધગતા ને અરણીની અગિન ॥૬॥ એ આદિ લેઈને
ધણી જતની અગિનછે॥ તેના એક તણુખામાં અ-
સંખ્યાતા લુન કર્યાછે॥ તેમાંથી એકેકો લુન નીકળીને
ખસખસના દાણા જેવડીકાયા કરેતો॥ જંયુદ્વિપમાં ન
માય॥ તેના કુળ નણુ લાખ કરોડ છે ॥ તેનું આ-
ઉઝું જધન્ય અંતર મુહુરતનું॥ ઉઠૃકૃદું નણુ અહો
રાત્રિનું॥ તેની દ્યા પાળીમેતો અનંતા મોકના

સુખ પામીએ॥ હવે વાયરાના એ લેણા॥ સુક્રમ અને
 ખાડર॥ સુક્રમ તે આખા લોકમાં ભર્યાછે॥ તે આ-
 પણું નજરે ન આવે॥ હવે ખાડર વાયરાના નામ
 કહેછે॥ પેહેલે બોલે ઉગમણો અને આથમણો વા॥૨॥
 ઉત્તરને દક્ષિણનો વા॥૩॥ ઊંચો નીચોને વિષો વા॥૪॥
 વટોળીએને મંણીએનો વા॥૫॥ ગુંજવાને સુધવા ॥૬॥
 આદિ લેધને ધણું જતનો વાયરો છે॥ તે
 શું કરે હળાય છે? ઉધારે મોઢે બોલ્યે॥ આ-
 પટ નાખવે ॥ સુપદે સોવે ॥ આટકવે ॥ કંત-
 વે ॥ વિઅવે ॥ તાલોટા વગાડવે ॥ વીંઝે વીંઅવે ॥
 હીંચોળે હીંચકવે ॥ આદિલેઈને ધણું જતના શાખ-
 કરી હળાય છે ॥ તે એકવાર ઉધારા મોઢે બોલ્યે ॥
 અસંખ્યાતા જીવ હળાયછે ॥ તેમાંથી એકેકો જીવ
 નીકળીને વહના બીજ જીવણી કાયા કરેતો ॥ જી-
 ઘુદ્ધિપમાં ન માય ॥ તેનાં કુળ સાત લાખ કરોડછે ॥
 તેનું આઉઝું જધન્ય અંતર મુહૂરતનું ॥ ઉઠકુઠું
 વણું હજર વર્ષનું ॥ તેની દ્યા પાળીએતો મોક્ષનાં
 સુખ પામીએ ॥ પાંચસે બોલે વનસ્પતિ કાય ॥ તે-

ના એ લેદ ॥ શુક્રમ અને ખાદ્ર ॥ સુક્રમ તે આપ્તા
 સોષ્ટમાં ર્થાછે ॥ તે આપાણી નજરે ન આવે ॥ ખા-
 દ્ર વનસ્પતિ કાયના એ લેદ ॥ પ્રત્યેક અને સાધા-
 રણ ॥ પ્રત્યેક કોને કહીએ ? શરીરે શરીરે અકેડા
 જીવ હોય તેને પ્રત્યેક કહીએ ॥ અને એક શરીરે અ-
 નંતા જીવ હોય તેને સાધારણ કહીએ ॥ હવે પ્રત્યેકના
 નામ કહેછે ॥ પેહલે ઓલે વૃક્ષને વેલાનો જત ॥ રી-
 ગાણી તળશી ને ગુંલમની જત ॥ એરડા આકડા ધ-
 તુરાની જત ॥ દાઢમ શોલદો ને ડેળાનીજત ॥ ધો ડે-
 વડો દાભડો ને તરણાનીજત ॥ ફૂલ કમળ ને નાગ-
 રવેલનીજત ॥ ઓરડો કેરડો ને કુસેલાની જત ॥ જી
 વાર ખાજરો મઠ મકાઈની જત ॥ તાંજળને સૂવા
 મોધરી વાળોલ કુળીની જત ॥ એ આનિ લેઇને ઘણી
 જતની પ્રત્યેક વનસ્પતિછે ॥ તેમાં ભગવાને નણુ પ-
 કારના જીવ કહ્યાછે ॥ સંખ્યાતા ॥ અસંખ્યાતા ॥ અ-
 ને અનંતા ॥ એ ત્રણુ પ્રકારના ॥ તેની દ્વારા પાળીએ
 તો મોકના સુખ પામીએ ॥ હવે સાધારણ વનસ્પતિ
 ના નામ કહેછે ॥ પેહલે ઓલે લીલદૂલ સેવાળની જ

(૧૬)

ત ॥ ગાજર મુળાની જત ॥ ડુંગળી લેસખુની જત ॥
 આહુ ને ગરમરની જત ॥ રતાળુ પીંડાળુંની જત ॥
 કંટાળો થોર ખરસ્યાળી કુંવાર સેલરાની જત ॥ મો
 થ લૂણુની જત ॥ ઉગતાં અંકૂરાં અને કૂણી કાકડીની
 જત ॥ એકૂણી વનસ્પતિ આદિ સર્વે જતની સાધા-
 રણુ વનસ્પતિ છે ॥ એક કંદમુળના કકડામાં અનંતા
 લુંછે ॥ તેનાં કુળ અઠાવીશ લાખ કરોડું ॥ તેનું
 આઉષું જધન્ય અંતર મૂહુરતનું ॥ ઉત્કૃષ્ટ દશાહ-
 જર વર્ષનું ॥ તેની દ્યા પાળીએ તો મોક્ષનાં સુખ-
 પામીએ ॥

હવે ત્રસકાયના ચાર ભેદું ॥ બેદાંદ્રી ॥ તે છંદ્રી ॥
 ચીરંદ્રી ॥ પચેંદ્રી ॥ હવે બેદાંદ્રીના બે ભેદ ॥ પ્રભાસા
 અને અપ્રભાસા ॥ બેદાંદ્રી તે કેને કહીએ ? જેને કાયા
 ॥ લુભ્યા ॥ બેદાંદ્રી હોય તેને બેદાંદ્રી કહીએ ॥ તેનાં
 નામ ॥ જળો પોરા કીડા કર્માચા સર્વમીચા મામણ
 મુંડા અળસીચા લટલાળ સંખ છીએ કોડા આદિસેદ
 ને ધણી જતના બેદાંદ્રી લુંછે ॥ તેનાં કુળ સાતલાખ
 કરોડું ॥ તેનું આઉષું જધન્ય અંતર મૂહુરતનું ॥ ઉ-

રહેંકું ખારવર્ષિણું ॥ તેની દ્યા પાળીએતો મોકના
 સુખ પામીએ ॥ તેછંડીના એ બેદ ॥ પ્રજન્મતા એ
 ને અપજન્મતા ॥ તેછંડી તે કોને કહીએ? કાયા
 મૂખને નાસિકા હોય તેને તેછંડી કહીએ ॥ તેના
 નામ જ્ઞા, લીખ ॥ ચાંચડ ॥ માંકડ ॥ કીરી ॥ એં-
 થવા ॥ માટલા ॥ ધનેરા ॥ જીવા ॥ ઇતરી ॥ ગીરોરા ॥
 ધીમેલ ॥ ગર્વેચા ॥ કાનખજૂરા ॥ મંકોરા ॥ એ
 આદિ ધાર્યો જતના તેછંડી લુચે ॥ તેનાકુંગ
 આઠ લાખકરોડ છે ॥ તેનું આઉઝું જધન્ય એંતર
 મુજૂરતનું ॥ ઉત્કૃષ્ટું ઓગળુંચાસ દિવસનું ॥ તેની
 દ્યા પાળીએતો મોકના સુખ પામીએ ॥ હુંચે ચ્છાઈ-
 દીના એ બેદ ॥ તે પ્રજન્મતા એને અપજન્મતા ॥ ચ્છો-
 ઈંડી તે કોને કહીએ? જેહને કાયા મુખ નાસિકા ને
 એંખ હોય તેને ચ્છાઈંડી લુચ કહેછે ॥ તેના નામા
 નાખી ॥ મસલા ॥ ડાંસ ॥ મર્યાદ ॥ ભરરા ॥ તીર ॥
 પતંગ ॥ કરોળીએ ॥ કંસારી ॥ વીંધી ॥ ખડમાંડ
 હી ॥ ખગા ॥ ધુહીએ ॥ કુદા ॥ એ આદી ધાર્યી
 જતના ચ્છાઈંડી લુચે ॥ તેનાં કૂળ નવલાખ કરોડ

છે ॥ તેનું આઉઝું જધન અંતર ભુહુરતનું ॥ ઉદ્ગ
 ાદું છ માસનું ॥ તેની દ્વા પાળીએ તો મોક્ષના
 સુખ પામીએ ॥ હવે પચદ્રી તે ડોને કહીએ? જેને
 કાય ॥ સુખ ॥ નાસિકા ॥ આંખ ॥ કાન ॥ એ પ્રમાણે
 હૃદય તેને પચદ્રી કહીએ ॥ તેના બેદ ॥ પ્રજાતા ॥
 અને અપ્રજાતા ॥ તેની ૪ જલ ॥ નારકી ॥ તિર્યં-
 ચ ॥ મનુષ્ય ॥ દેવતા ॥ તેમાં ૧૪ બેદ ના
 રકીના ॥ ૪૮ બેદ તિર્યંચના ॥ ૩૦૩ બેદ મનુષ્ય-
 ના ॥ ૧૯૮ બેદ દેવતાના ॥ વળીતેમાં ચાર બેદ ॥ જ
 વનપત્રિ ॥ વાળુષ્યંતર ॥ જેતથી ॥ વૈમાનીક ॥ મનુ-
 ષ્યના ચાર બેદ ॥ ૧૫ કર્મ ભૂમિના મનુષ્ય ॥ ૩૦ ચ
 કર્મ ભૂમિના મનુષ્ય ॥ ૫૮ અંતર દ્વિપના મનુષ્ય ॥
 ૧૪ સ્થાનકના સમૂહિત મનુષ્ય ॥ તે કહેછે ॥ પેહુલે જોલે
 લધુનિતમાં ઉપજે ॥ ૧ ॥ વરી નીતમાં ॥ ૨ ॥ બળઘા
 મા ॥ ૩ ॥ લાંટમાં ॥ ૪ ॥ વમનમાં ॥ ૫ ॥ પીતોડમાં
 ॥ ૬ ॥ ૫૩માં ॥ ૭ ॥ લોહીમાં ॥ ૮ ॥ વિર્ધમાં ॥ ૯ ॥ વિ
 દ્વાદિકના પુદ્ગળ સૂકાણા ત કરી ભીના થાય તેમાં
 ॥ ૧૦ ॥ મનુષ્યના કલેવરમાં ॥ ૧૧ ॥ કૃતી પુરૂષના સં-

योगमां ॥ १२ ॥ लगरनी भालपभुष्ममां ॥ १३ ॥ सर्व
 मनुष्य रांण्डी असूची स्थानकमां ॥ १४ ॥ ए १४ स्था
 नके समूर्छिम मनुष्य उपनेष्टे ॥ हवे नारकीनी स्थिति
 जधन्य दसाहनर वर्णनी ॥ उत्कृष्टी ३३ सागरनी ॥
 तिथ्यनी स्थिति जधन्य अंतर मूङ्गरतनी ॥ उत्कृष्ट
 वाणु पट्यनी ॥ मनुष्यनी स्थिति जधन्य अंतर मू
 ङ्गरतनी ॥ उत्कृष्ट ३ पट्यनी ॥ देवतानी स्थिति
 जधन्य १० हुलर वर्णनी ॥ उत्कृष्टी ३३ सागरनी ॥
 तेनी हया पाणीअमेता मोक्षना सुअ पामीअ ॥ हृ
 तिश्री छकायना भोल समृद्ध.

—०—

अथ देव, गुरु, धर्म ए त्रण तत्वनी ओ
 लखाण विषे.

—०—

चोपाइ.

पूर्व पुरुष पूर्वमेश्वर देव ॥ तोह ताणु नीत कीजे सेव ॥
 अवहुभ भञ्जन श्री अरिहंत ॥ लगदेपनो कीयो अत ॥

॥ १ ॥ चोनिश अतिराय रोलित कीय ॥ विलुवनज
 न नायक जिनराय ॥ पांचीश वाणी वचन रसाय ॥
 शिवसुभ कारण हीनदयाण ॥ २ ॥ सुरिनर किनर वं-
 धीत पाय ॥ ज्यज्गटिक्षर विलुवनराय ॥ सिंह पु-
 र३ अनियण सुभ धाणी ॥ सेवा करे भविजन ते
 तणि ॥ ३ ॥ अष्ट करम दण कीधाचुर ॥ चिदानंद नि-
 ति सुभ भरपुर ॥ अनांत ज्ञान दरशन आधार ॥
 इद्रिय हेहु रहित आकार ॥ ४ ॥ तेने जन्म जरा
 नहीं रोग ॥ नहिं सुनदारा नहिं तस बोग ॥ नहिं
 तस मोहु नहिं तस भान ॥ नहिं तस भाया नहीं अज्ञान
 ॥ ५ ॥ नहिं तसवेरी नहिं तसमिन ॥ ज्ञान३४ ज्गनाथ
 पवित्र ॥ तेप्रभुनविसर्जे संहुरे ॥ रागद्रौपते चितनवि-
 धरे ॥ ६ ॥ ते प्रभु नवि पामे अवतार ॥ आहीअंत
 नहिं तेनो पार ॥ ते प्रभु नवि लीला चीत धरे ॥ ते
 प्रभु हास्य कीरा नवि करे ॥ ७ ॥ ते प्रभु नवि नाचे
 नवि गाय ॥ ते प्रभु भोजन काँध नवि खाय ॥
 ते प्रभु पुर्य पुज शुं करे ॥ ते प्रभु गदा अङ नवि
 धरे ॥ ८ ॥ ते प्रभु शुण धरे नहिं पाणी ॥ साचो

(२१)

जगदिक्षर लयो जाणु ॥ वेद पुराणु सिंवांत विचार ॥
अे जगदिक्षर नहु संसार ॥ ८ ॥ अे जगदिक्षर
माने ज्ञेह ॥ निराभाध सुभ पामे तेह ॥ अहु तज्ज
भीजे केाणु धाय ॥ अथत छाणी विख केाणु धाय
॥ १० ॥ २८ चिंतामणी नाभि करी ॥ केाणु थहे
कर काच ढीकरी ॥ पोली भूठी दीसे असार ॥ ५७ र
वाहे नहीं भव पारा ॥ ११ ॥ अथवा मोहुचं शिल नवि-
लहे ॥ देणी पृथर सोवन कहे ॥ नेव रोग पीडीत होय
ज्ञेह ॥ पीत शांख नर भाघे तेह ॥ १२ ॥ सुशुर भये ज्ञे
पुन्य संज्ञेग ॥ जय मिथ्या भतनोतो रोग ॥ सुशुर
तारे ने पोते तरे ॥ उपकार नाव तणु पेरे करे ॥ १३ ॥
कोध मान भमता परिहरे ॥ नस यावरनी रक्षा करे ॥
सत्य वचन मुखथी उच्चरे ॥ कुट कुपट ते चित नवि-
धरे ॥ १४ ॥ अणुदीधुं ते गुरुलु नवि थहे ॥ १५ ॥ धर्म
भविजनने कहे ॥ नारितछिं संगती परिहरे ॥ अल-
चर्ष्वित चोमुधरे ॥ १५ ॥ नव विध वाट विसु-
ध वृत धरे ॥ ते गुरु तारे ने अं तरे ॥ काम लोग

(२२)

लालच्य परिहरे॥ सिलांगरथ गुणुते आदरे ॥१६॥
अब्लयर्थ पाभि गुरु होय॥ तो गुरु थाये जग सहु
केय ॥ गृहस्थ गुरु थहने थुं करे ॥ लोह संग
पथर केम तरे ॥१७॥ तारे गुरु महावत धार ॥
पंडित जन घेम कहे विचार ॥ कनक रजत धन
भमता तल ॥ मुकी लोभ धर्म साधन भजि ॥१८॥
घणि पेर पंच वृत धरे ॥ आर कशाय मुनिवर
परि हरे ॥ शाख तण्डो नित हे उपहरा ॥ श्री
गुरु टाणो सकण क्लेश ॥१९॥ राग द्वेष मोह
टाणि करी ॥ घेवा मुनिवर लड़ शिवपुरी ॥ तरवा
जे वंछा संसार ॥ तो आराधो गुरु वत धार॥२०॥
दया धर्म उपहरो सार ॥ जिव सरवेने करे उपकार
॥ दया धर्म मोटो जग सही ॥ जेथी हुःअ कोइ
पामे नहि ॥२१॥ कुंजन दया दया मुख भणि ॥
धर्म काजे तस थावर हुणे ॥ बोले साचुं पण
नवि करे ॥ कहो ते केम भव सागर तरे ॥२२॥
दया विना जे थाघे धर्म ॥ तो हिंसाए नवि लागे
कर्म ॥ जे तपस्या धर घेठा थाय ॥ तो धर छंडी

વન કોણુ જય ॥ ૨૩ ॥ સર્વે શાસ્ત્રે એ નીચે સહિ
 ॥ દ્વા વિના ધર્મ થાએ નહિ ॥ જ્યાં હિંદા તાં
 પાતક હોય ॥ પંહિત શાસ્ત્ર વિચારિ જ્ઞેય ॥ ૨૪ ॥
 પૃથ્વી પાણી અભિ વાય ॥ વનસ્પતિ પંચ થાવર
 કાય ॥ દ્વિ વિય ચેંદ્ર પચંદ્રી સાર ॥ નસ જિજ્વા એ
 અગમ સુવિચાર ॥ ૨૫ ॥ જૈત શિવ પણ એ જીવ
 કહે ॥ એ રાખે તો રિન સુખ લહે ॥ એહ વચન
 નવિ માને જેહ ॥ ભવ બંધન નવિ છુટે તેહ ॥ ૨૬ ॥
 હરિહર અજ્ઞા યુધ જિન રાય ॥ તેહ તણું જે રેને
 પાય ॥ તે પણ ધર્મ કરે તો તરે ॥ પાય કરે તો
 ભવમાં કરે ॥ ૨૭ ॥ દેવ નિરંજન ગુરુવત ધાર ॥
 ધર્મ દ્વામય રીવ સુખકાર ॥ તત્ત્વ નણું સમકિત
 કેવાય ॥ એ આરાધે શિવ સુખ થાય ॥ ૨૮ ॥ ભવિ
 આળુ પામિ મનુષ અવતાર ॥ એ સમકિત આરા
 ધોસાર ॥ ઇથિ લાલા તણે શું પસાય ॥ રામ સુ
 ની ભણે એ સાય ॥ ૨૯ ॥ || સમખૂર્ણ ॥
 નમો અરિ હંતાણ = કર્મરૂપી . વેરીને જીવા છે તેને
 નમસ્કાર .

(२४)

नमो सिद्धाण्डं = सकृण कारज सिद्ध कर्या तेने
नमस्कारः

नमो आयरीयाणं = छनीश गुणे करी सहित
अवा आचार्यने नमस्कारः.

नमो उवद्ज्ञायाणं = पचीस गुणे करी सहित
भणे ने भणुवे अवा वे उपाध्यायने नमस्कारः.

नमो लोए सब्ब साहूणं = लोडेने विशे ७०८
वे हुजर करोइ साहु उत्कृष्टनव हुजर करोइ साहु
अे सरवेने नमस्कारः.

अक अक्षर नवकारनो, सुन्द गणे वे सारः;
ते खांधे सुब्ब देवनु, आयुष अपरंपारः ॥१॥
बोग्णीश लाख व्रेसठहुजर, खसें खासठ ५७;
त्यांहां सुधी ते लोगवे, नवकार भंतनुँझण ॥२॥
असुब्ब कर्चे दे हुरण्णु, भंत खडो नवकारः;
भांखीद्वाद्दस अंगमे, देख लीओ तत्व सारः ॥३॥

(२५)

अणू पर्वि,



क्र० १ लो.

क्र० २ जे.

१	२	३	४	५
२	१	३	४	९
१	३	२	४	५
३	१	२	४	५
२	३	१	४	५
३	२	१	४	५

१	२	४	३	५
२	१	४	३	५
१	४	२	३	५
४	१	२	३	५
२	४	१	३	५
४	२	१	३	५

क्र० ३ जे.

क्र० ४ थे।

१	४	४	२	५
३	१	४	२	५
१	४	३	२	५
४	१	३	२	५
३	४	१	२	५
४	३	१	२	५

२	३	४	१	५
३	२	४	१	५
२	४	३	१	५
४	२	३	१	५
३	४	२	१	५
४	३	२	१	५

(२६)

કેટો ૫ મો.

૧	૨	૩	૪	૪
—	—	—	—	—
૨	૧	૩	૪	૪
—	—	—	—	—
૧	૩	૨	૪	૪
—	—	—	—	—
૩	૧	૨	૪	૪
—	—	—	—	—
૨	૩	૧	૪	૪
—	—	—	—	—
૩	૨	૧	૪	૪

કેટો ૬ ટો.

૧	૨	૪	૩	૪
—	—	—	—	—
૨	૧	૪	૩	૪
—	—	—	—	—
૧	૫	૨	૩	૪
—	—	—	—	—
૫	૧	૨	૩	૪
—	—	—	—	—
૨	૫	૧	૩	૪
—	—	—	—	—
૫	૨	૧	૩	૪

કેટો ૭ મો.

૧	૩	૪	૨	૪
—	—	—	—	—
૩	૧	૪	૨	૪
—	—	—	—	—
૨	૫	૩	૨	૪
—	—	—	—	—
૫	૧	૩	૨	૪
—	—	—	—	—
૩	૫	૧	૨	૪
—	—	—	—	—
૫	૩	૧	૨	૪

કેટો ૮ મો.

૨	૩	૪	૧	૪
—	—	—	—	—
૩	૨	૪	૧	૪
—	—	—	—	—
૨	૫	૩	૧	૪
—	—	—	—	—
૫	૨	૩	૧	૪
—	—	—	—	—
૩	૫	૨	૧	૪
—	—	—	—	—
૫	૩	૨	૧	૪

(२७)

કેટો ૮ મો.

૧	૨	૪	૫	૩
—	—	—	—	—
૨	૧	૮	૪	૩
—	—	—	—	—
૧	૮	૨	૪	૩
—	—	—	—	—
૪	૧	૨	૪	૩
—	—	—	—	—
૨	૪	૧	૪	૩
—	—	—	—	—
૪	૨	૧	૪	૩

કેટો ૧૦ મો.

૧	૨	૪	૪	૩
—	—	—	—	—
૨	૧	૪	૪	૩
—	—	—	—	—
૧	૪	૨	૪	૩
—	—	—	—	—
૪	૧	૨	૪	૩
—	—	—	—	—
૨	૪	૧	૪	૩
—	—	—	—	—
૪	૨	૧	૪	૩

કેટો ૧૧ મો.

૧	૪	૪	૨	૩
—	—	—	—	—
૪	૧	૪	૨	૩
—	—	—	—	—
૧	૪	૪	૨	૩
—	—	—	—	—
૪	૧	૪	૨	૩
—	—	—	—	—
૪	૪	૧	૨	૩
—	—	—	—	—
૪	૧	૨	૨	૩
—	—	—	—	—
૪	૪	૧	૨	૩
—	—	—	—	—
૪	૪	૨	૧	૩
—	—	—	—	—
૪	૪	૨	૨	૩

કેટો ૧૨ મો.

૨	૩	૪	૧	૩
—	—	—	—	—
૪	૨	૪	૧	૩
—	—	—	—	—
૨	૪	૪	૧	૩
—	—	—	—	—
૪	૨	૪	૧	૩
—	—	—	—	—
૪	૪	૨	૧	૩
—	—	—	—	—
૪	૪	૨	૧	૩
—	—	—	—	—
૪	૪	૧	૨	૩
—	—	—	—	—
૪	૪	૧	૨	૩

(૨૮)

કેટો ૧૩ મેલ.

૧	૩	૪	૫	૨
—	—	—	—	—
૩	૧	૪	૫	૨
—	—	—	—	—
૧	૮	૩	૫	૨
—	—	—	—	—
૪	૧	૩	૫	૨
—	—	—	—	—
૩	૪	૧	૫	૨
—	—	—	—	—
૪	૩	૧	૫	૨

કેટો ૧૪ મેલ.

૧	૩	૪	૫	૨
—	—	—	—	—
૩	૧	૪	૫	૨
—	—	—	—	—
૧	૫	૩	૪	૨
—	—	—	—	—
૪	૧	૩	૪	૨
—	—	—	—	—
૩	૪	૧	૪	૨
—	—	—	—	—
૪	૩	૧	૪	૨

કેટો ૧૫ મેલ.

૧	૪	૫	૩	૨
—	—	—	—	—
૪	૧	૫	૩	૨
—	—	—	—	—
૧	૫	૪	૩	૨
—	—	—	—	—
૪	૧	૬	૩	૨
—	—	—	—	—
૪	૪	૧	૩	૨
—	—	—	—	—
૪	૪	૧	૩	૨

કેટો ૧૬ મેલ.

૩	૪	૫	૧	૨
—	—	—	—	—
૪	૩	૫	૧	૨
—	—	—	—	—
૩	૫	૪	૧	૨
—	—	—	—	—
૪	૩	૪	૧	૨
—	—	—	—	—
૪	૪	૩	૧	૨
—	—	—	—	—
૪	૪	૩	૧	૨

(२५)

કોડો ૧૭ મો.

૨	૩	૪	૫	૧
—	—	—	—	—
૩	૨	૪	૫	૧
—	—	—	—	—
૨	૪	૩	૫	૧
—	—	—	—	—
૪	૨	૩	૫	૧
—	—	—	—	—
૩	૪	૨	૫	૧
—	—	—	—	—
૪	૩	૨	૫	૧

કોડો ૧૮ મો.

૨	૩	૪	૫	૧
—	—	—	—	—
૩	૨	૪	૫	૧
—	—	—	—	—
૨	૪	૩	૫	૧
—	—	—	—	—
૪	૨	૩	૫	૧
—	—	—	—	—
૩	૪	૨	૫	૧
—	—	—	—	—
૪	૩	૨	૫	૧

કોડો ૧૯ મો.

૨	૪	૪	૩	૧
—	—	—	—	—
૪	૨	૪	૩	૧
—	—	—	—	—
૨	૪	૮	૩	૧
—	—	—	—	—
૪	૨	૮	૩	૧
—	—	—	—	—
૪	૨	૮	૩	૧
—	—	—	—	—
૪	૪	૨	૩	૧
—	—	—	—	—
૪	૪	૨	૩	૧

કોડો ૨૦ મો.

૩	૪	૪	૨	૧
—	—	—	—	—
૪	૩	૪	૨	૧
—	—	—	—	—
૩	૪	૪	૨	૧
—	—	—	—	—
૪	૩	૪	૨	૧
—	—	—	—	—
૪	૪	૩	૨	૧
—	—	—	—	—
૪	૪	૩	૨	૧

चोवीस तिर्थकरनां नाम.

—तेजोंहृष्टे—

॥१॥ श्री अपभद्रेव ॥२॥ श्री अल्लतनाथज् ॥३॥ श्री
संभवनाथ ॥४॥ श्री अभिनंदन ॥५॥ श्री सुभती
नाथ ॥६॥ श्री पद्मप्रभु ॥७॥ श्री सुपार्वतनाथ
॥८॥ श्री अद्रप्रभु ॥९॥ श्री सुभुद्धिनाथ ॥१०॥
श्री शीतणनाथ ॥११॥ श्री श्रेयांसनाथ ॥१२॥ श्री
वासुपूज्यस्वामी ॥१३॥ श्री विभग्ननाथ ॥१४॥ श्री
अनंतनाथ ॥१५॥ श्री धर्मनाथ ॥१६॥ श्री शांति-
नाथ ॥१७॥ श्री कुञ्चुनाथ ॥१८॥ श्री अरनाथ ॥१९॥
श्री भलिलनाथ ॥२०॥ श्री मुनिसुवतस्वामी ॥२१॥
श्री नमीनाथ ॥२२॥ श्री नेमनाथ ॥२३॥ श्री पा-
र्वनाथ ॥२४॥ श्री महावीरस्वामी.

माहावीरस्वामी पोत्या निरवाणु. जौतम
स्वामि डेवणज्ञान. ए चोवीशीतुं दीक्षे नाम जे
थी इणे वांच्छीत काम ॥१॥

कृष्णकृष्णकृष्णकृष्णकृष्णकृष्ण

(૪૧)

દરરોજ નિયમો ધારવાની વીગત. (ગાથા.)

૧ સચિત ૨ ક્રાંતિ ૩ વિર્ય ૪ વાણી ૫ તંબોળ ૬ વથ
૭ કુસુમસુઃ ૮ વાહન ૯ સયણ ૧૦ વિલેવણઃ ૧૧ અંભઘ
૧૨ દીશી ૧૩ નહાણું ૧૪ ભતેસુઃ ॥ ૧ ॥

શબ્દ

અર્થ

૧ સચિત.

માટી, પાણી, આરી, વનસપ્તી, રૂળ,
કુળ, ખાલ્ય, કાષ, મુળ, પત્ર, ખીલ,
તથા ને લીલુ છેદાને એ ધડી થઈ ન હોય
તે તથા આગિન પ્રમુલ આનેદ શસ્ત્ર લાગુ
નહી તે ઘત્યાદી સચિતનું વચ્ચન ધારવું.

૨ દ્રોધ.

ને વરતું સુખામાં શુદ્ધ મ્યાહને આરયે
નાખી, તેણી ગણુતીનો, નિયમ, ઉદાહરણઃ;
દાતણ પાણી વીગરે ગણુતરી કરવી.

૩ વિગય.

દૂધ, દાઢી, ધી, ગોળ, તેલ, તથા ને ઓઝ
કહાંડમાં તળાયછે તેણી ગણુતી ધારવી.

૪ વાણી

પગરાણાં અથવા જેડાતથા ચોજ વીગ
રેણી ગણુતી ધારવી.

૫ તંબોળ.

પાન, સોાયારી, ઘલાયચી, લવોંગ, ચુરણ
ગોળી, ઘત્યાદિનું વજાન.

૬ વથ.

વથ (રેખમી, સુતરાઉ, થણ તથા ઉનાં) વીગરેણી ગણુતી કરવી.

૭ કુસુમસુ.

ને વરતું નાકે સુધવામાં આવે તેના તેલ
નું પ્રમાણ ઉદાહરણઃ - ધીકણી વીગરે.

૮ વાહન.

અરતુ, કરતુ, નરતુ, ઉદાહરણઃ - હાથી ચો
ડા, ગાડી, રથ, નાગ, વહાણ બોટ.

૯ સયણ.

સુવાળી સંજ્યા, પાઠ, પાઠલા, પીછાળા,
વીગરેણી ગણુતી.

૧૦ વિલેવણ.

ને વરતુ શરીરે ચોપડવામાં આવે તેના
વજનનું ઉદાહરણઃ - સુખાં, ચંદન.

(૩૨)

- ૧૧ બંલર્દ.
૧૨ દિશી અલખચર્યનો નિયમ.
૧૩ નાહાણ પૂર્વ, પચ્છિમ, ઉત્તર, દક્ષિણ, ભાગું, નીચું, એ છ દીશાઓ જવાના ગાઉનું પ્રમાણ.
૧૪ ભતેસુ. બ્ધે અંગે નહાડું તેની ગણૂટી.
૧૫ પ્રથિવકાય જગતા બોજન, પાણી વાપરવું તેના વ જનનું પ્રમાણ.
૧૬ અપકાય માઢી, મીઠાં, ઝડી, રમદી, વીગરે વાપર વાના વજનનું પ્રમાણ.
૧૭ તેબિકાય દાહાડું તથા હુંનું પાણી, પીપા તથા વા પરયા તથા નાદ્ધા, વીગરેના ડામમાં આવે તે સરવેના વજનનું પ્રમાણ.
૧૮ વાડિકાય રથારી ચુંદુલા, દીવા, સગડીઓ વીગરે રણગાવવાળી ગણૂટીનું પ્રમાણ તથા તેના પ્રમાણગાં રંધિલુ જમવાનો નિયમ.
૧૯ વનરથ (તી કાય.) પંખાથી, તથા લુગડાથી પવન વાખ્યો તથા ઝડું, તથા હિંચવું, તેનું પ્રમાણ.
૨૦ ત્રસકાય ક્ષીલાતરી, રણ, શાક, બાળ, વીગરેનું પ્રમાણ ઐયદ્રીથી તે પચદ્રી સુધીના નિરાયપરાધી નસજીવને કું ક્ષિંગે કરી હલ્સુંવો નહી તે વીઘેનો નિયમ.
૨૧ અસીં. તરવાર, બંડક, છરી, છરા, ચાપા વીગરે સંખ્ય ધારણ કરવાનું પ્રમાણ.
૨૨ ગંગી. અડીઓ, દાતો, કલમો, વીગરે રૂશ-નાધના વાસણી ગણૂટી.
૨૩ ફથી. જમીન ખાદવાનું, ધર, સ્ક્રેટ, ટાંકા, ભોયરાં તળાવ, વાંય, કુવા, વીગરે ખાદવાના રાચનું પ્રમાણ તથા તે વાપરવાનું પ્રમાણ.
એ શુંતે બાપર લખલા નીયમો દરરાજ ધારવા એ
આવક દોડાનો મુખ્ય ધરમ છે.

सूचना पत्र.

आ योपही नीचे सभेके हेकावे रोकडी कीमते
भण्ठो. परदेशथी भंगावनारे ट्याल खरय ज्याहे
आपवो पहरो.

लीभडी—रोठ हुरज्जवन कस्तुर, गांधी झाधु

काहुनज्ज ने रोठ कानज्ज सुंदरज्ज

घोलेरा—शाहु मेती वलम.

वढवाणु—माणुक्यंद होसाभाई वोरा.

धांगधरा—माथकीज्ञा वणतयंद पानायंद.

सायला—रोठ इतेयंद काणुभाई.

मोरणी—होरी त्यालयंद ज्जवराज.

माटवी—शाहु साफरयंद खीमराज.

अंलर—शाहु करभयंद धरभरी

भुज—मेहेता आगुंदेल पीताभर.

धोराज्ज—शाहु काणीदास धाररी.

ज्जेतधुर—मेहेता जोपालज्ज चतुरभुज.

सुरा—गांधी ठाकररी नानज्ज.

राज्जेकाट—गांधी भाईयंद काहुनज्ज. डॉ. हाईस्कूल.

सभतर—रोठ वङ्गमान जेशंग.

